

ત્વરિત જાહેરાત માટે

સિટી ઓફ બ્રેમ્પટન ઉજવી રહ્યા છે અશ્વેત ઇતિહાસ માસ (Black History Month)

બ્રેમ્પટન, ઓન્ટારિયો (28 જાન્યુઆરી 2022) – ફેબ્રુઆરી મહિનામાં સિટી ઓફ બ્રેમ્પટન અશ્વેત ઇતિહાસ માસ ઉજવીને બ્રેમ્પટનમાં રહેલ અશ્વેત સમાજના યોગદાન અને સિદ્ધિઓને સન્માનિત કરે છે જેમણે ઇતિહાસમાં એટલું બધું પ્રદાન કર્યું છે જેથી બ્રેમ્પટન આજે આતંત્રું રહેવા લાયક, કક્ષામય અને સમૃદ્ધ શહેર બની શક્યું છે. આખો ફેબ્રુઆરી મહિનો રૂબરૂ અને ઓનલાઇન ઇવેન્ટ્સથી ભરચક રહેશે.

બ્લેક હિસ્ટરી મન્થ ધ્વજરોહણ

કેન વિલિઅન્સ સ્ક્વેર

ફેબ્રુઆરી 1, બપોરે 12 વાગ્યે

પેન-અમેરિકન ધ્વજરોહણ કરીને મહિનાની શુભ શરૂઆત થશે અને તે આખા ફેબ્રુઆરી માસમાં ફરકતો રહેશે.

બ્લેક બિઝનેસ આર્ટિસન માર્કેટ – સ્વાલિ આફ્રિક (Reveiller Afriq)

બ્રેમલિ સિટી સેન્ટર

ફેબ્રુઆરી 8 & 9, સવારે 10 થી રાત્રે 10

બ્રેમલિ સિટી સેન્ટરની ભાગીદારીમાં થનાર આ બે-દિવસના રૂબરૂમાં થતા બજાર અનુભવમાં સ્થાનિક અશ્વેતની માલિકીના વ્યવસાયો, ઉત્પાદકો અને કારીગરોને ટેકો આપો. બેસ્ટ બાય પ્રવેશદ્વારમાંથી જતા બીજે માળે પોપ-અપ મેળવો.

સાપ્તાહિક પર્ફોર્મન્સ સિરિઝ

મંગળવારની રાત્રિઓ, સાંજે 8 – 10 વાગ્યા સુધી

rosetheatre.ca

આખા મહિનામાં દર મંગળવારે રાત્રે બ્લેક હિસ્ટ્રીની ઉજવણી કરવા માટે મનોરંજક ઓનલાઇન પ્રદર્શન સિરિઝનો આનંદ લો. પરફોર્મન્સનું લાઇવસ્ટ્રીમિંગ સીધું રોઝ થિએટરના સ્ટેજ પરથી થશે.

- ફેબ્રુઆરી 1: DJ યુદ્ધ જેમાં ભાગ લેશે DJ એલન અને DJWHATSNEXT
- ફેબ્રુઆરી 8: શેડ વાહીદ (Shade Waheed) સાથે ઓફ ટેકોર્ડ (Off the Record) દ્વારા ક્યુરેટ કરેલ લાઇવ કાર્યક્રમ
- ફેબ્રુઆરી 15: [ACCIDA](#) ની ભાગીદારીમાં ડેસ મેકેન્ઝી (Des McKenzie) નો કાર્યક્રમ

- ફેબ્રુઆરી 22: [ACCIDA](#) ની ભાગીદારીમાં ટ્રાવિસ નાઈટ્સ (Travis Knights) નો કાર્યક્રમ

સાપ્તાહિક લન્ચ'એન'લર્ન્સ (Lunch'n'Learns)

દર બુધવારે બપોરે 12- 1

સાપ્તાહિક શૈક્ષણિક સત્ર માટે [MOYO Health & Community Services](#) (આરોગ્ય અને સામુદાયિક સેવાઓ) માં જોડાઓ.

વિષયોમાં સમાવેશ થાય છે:

- ફેબ્રુઆરી 2: ABR નો પરિચય, આંતરછેદ, સત્તા અને વિશેષાધિકાર,
- ફેબ્રુઆરી 9: અશ્વેત મહિલાઓને સમર્થન
- ફેબ્રુઆરી 16: અશ્વેત 2SLGBTQ+ વ્યક્તિઓને સમર્થન
- ફેબ્રુઆરી 23: અશ્વેત ઉત્કૃષ્ટતાની વધામણી

બ્લેક હિસ્ટરી મન્થ એક્સપિરિયન્સ બોક્સ

લોકપ્રિય એક્સપિરિયન્સ બોક્સ આ વર્ષે ફરી થશે. આ મર્યાદિત સંસ્કરણવાળા ક્યુરેટ કરેલા ગિફ્ટ બોક્સમાં એવા ઉત્પાદો અને સેવાઓ હશે જે સ્થાનિક અશ્વેત માલિકીના વ્યવસાયો પાસેથી આવ્યા હોય. તમામ બોક્સમાં હશે:

- [AuxGod Music Battle Card Game](#)
- [Sugar Plum Scrubs](#)નો લવેન્ડુલા અને ટી ટ્રી ઓઈલ બોડી સ્કબ
- વોક ઓફ ફેમમાં દાખલ થયેલ [આયન વિલિયમ્સ \(Ian Williams\)](#) નું પુસ્તક *ડિસઓરિએન્ટેશન (Disorientation)*
- અને બીજું ઘણું!

[સામાજિક સંક્રમણ માટે પુનઃસ્થાપન અને સશક્તિકરણ \(Restoration and Empowerment for Social Transition\)](#) અથવા

અશ્વેત સશક્તિકરણ સંગઠન (R.E.S.T.)ને ઓછામાં ઓછા \$20 નું સખાવતી દાન કરનાર પ્રથમ 50 લોકોને આ બોક્સ ડિલિવર કરવામાં આવશે.

સુખાકારીની ક્ષણો

પ્રખ્યાત યોગ શિક્ષક અને બ્રેમ્પટનના મૂળ નિવાસી મેથ્યુ બોનાસ સાથે સાપ્તાહિક સુખાકારીની ક્ષણો માણવા જોડાઓ જેમાં સામેલ છે કપલ ફિટનેસ અને યોગ. પ્રત્યેક સપ્તાહે નવો વર્ગ ઉપલબ્ધ છે.

બ્લેક આર્ટિસ્ટ લાઈવ ડિજિટલ પ્રદર્શન

ગાર્ડન સ્કવેર

રજૂઆતકર્તા [ACCIDA](#)

આર્ટસ, કલ્ચર એન્ડ ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ એજન્સી (ACCIDA) બ્લેક આર્ટિસ્ટ્સ લાઈવ લિઅર રજૂ કરશે, જે ગાર્ડન સ્ક્વેરમાં 24' LED સ્ક્રીન પર PIXEL ડિજિટલ સ્ક્રીન પ્રદર્શનના રૂપે હશે, જેમાં ફેબ્રુઆરીથી મે 2022 સુધી આઠ સ્થાનિક કલાકારો, સર્જનકર્તાઓ અને સંસ્થાઓનું કાર્ય દર્શાવવામાં આવશે.

તેમના ઉદાર ટેકા માટે અલગોમા યુનિવર્સિટી, બ્રમ્પટન રિઅલ એસ્ટેટ બોર્ડ અને સન લાઈફને ધન્યવાદ.

બ્લેક હિસ્ટ્રી મન્થના ઇવેન્ટ્સ અંગેની વધુ માહિતી માટે brampton.ca/bhm2022

સુવાક્યો

"બ્રમ્પટનમાં અશ્વેત સમુદાયના સભ્યોના મહત્વપૂર્ણ કાર્ય, પ્રતિભા અને યોગદાનને ઓળખવા અને તેનું સન્માન કરવા માટે બ્લેક હિસ્ટ્રી માસની ઉજવણીમાં અમારી સાથે જોડાઓ. બ્રમ્પટનની સાંસ્કૃતિક વિવિધતા એ છે જે આ શહેરને ખૂબ જ ખાસ બનાવે છે, અને તે મહત્વપૂર્ણ છે કે આપણે આપણા ઇતિહાસ અને સમુદાયને સ્વીકારીએ જેથી આપણે એક શહેર તરીકે આગળ વધીને વિકાસ કરવાનું ચાલુ રાખી શકીએ."

- *પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન*

"બ્રમ્પટનનો અશ્વેત સમાજ આપણા શહેરના પચરંગીપણા અને સ્થાનિક ઓળખનો મહત્વપૂર્ણ ભાગ છે. હું બધાને પ્રોત્સાહિત કરું છું કે આપણા મહાન શહેરમાં રહેલ અશ્વેત સમાજ વિશે જાણી લો અને બ્લેક હિસ્ટ્રી મન્થની ઉજવણીમાં અમારી સાથે જોડાઈ જાઓ. ભવિષ્યમાં એક વધુ મજબૂતી ધરાવતું શહેર બનવા માટે આપણે આપણી જાતને આ બાબતે જાણકાર બનાવવી પડશે અને એક જ સમાજ તરીકે જોડાવું પડશે."

- *શેરમેન વિલિયમ્સ (Charmaine Williams) સીટી કાઉન્સિલર, વોર્ડ 7 અને 8, સીટી ઓફ બ્રમ્પટન*

"બ્લેક હિસ્ટ્રી મન્થ આપણને યાદ અપાવે છે કે આપણા પચરંગી શહેર અને આર્થિક ફલક પર બ્રમ્પટનના અશ્વેત સમાજની ભૂમિકા બ્રમ્પટનમાં કેટલી નોંધપાત્ર રહી છે. અશ્વેત સમાજના દીર્ઘકાલિક સમર્થનમાં સીટી ઓફ બ્રમ્પટન આ સિદ્ધિઓને વધાવવામાં ભાગ ભજવે છે તેનો મને આનંદ છે. આખો મહિનો જાણવા, જોડાવા અને ઉજવણી કરવા માટે અમારી સાથે જોડાઈ જાઓ."

- *ડેવિડ બાર્રિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સીટી ઓફ બ્રમ્પટન*

"બ્રમ્પટન ખરેખર એક પચરંગી સંસ્કૃતિ, ઇનોવેશન, વૈવિધ્ય અને પ્રતિભાનો ખજાનો છે અને એક વૈશ્વિક ગ્રામ હોવાનું સુંદર ઉદાહરણ છે જે એક બીજાના યોગદાન અને અનન્યતાને વધાવી લે છે. યુવા પેઢીઓ બ્લેક હિસ્ટ્રી મન્થની ઉજવણીથી જાણકારી મેળવે તે અતિમહત્વપૂર્ણ છે

જેથી અશ્વેત સમાજના યોગદાન વિશે અને તેઓ દાયકાઓથી કેનેડાને કેટલું પ્રદાન કરી ચુક્યા છે તે અંગે જાગૃકતા આવે."

- મિશેલ બર્ન, મેનેજર, ઈકિવટી ઓફિસ

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca